

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ

બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

હેલ્પલાઇન નંબર:- ૦૭૯-૨૩૨૫૮૫૬૩ (કામકાજના દિવસો અને કચેરી સમય દરમ્યાન)

પ્રોવીઝનલ મેરીટયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર ધ્વારા નીચે દર્શાવ્યા મુજબના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા નવેમ્બર ૨૦૧૮ માસમાં લેવાયેલ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બોર્ડ ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે સરકારશ્રીના પંચાયત વિભાગની વેબસાઇટ <https://panchayat.gujarat.gov.in> ઉપર મુકવામાં આવેલ છે. આ પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે બોર્ડની કચેરીએ અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના એસ.એમ.એસ ઉમેદવારોને તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર મોકલવામાં આવેલ છે. આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને નીચે દર્શાવ્યા મુજબની તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે બોર્ડની કચેરીએ જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે પંચાયત વિભાગની વેબસાઇટ <https://panchayat.gujarat.gov.in> જોવી.

જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	પ્રમાણપત્ર ચકાસણીની તારીખ અને સમય	પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મુજબ ઉમેદવારોનાં ક્રમાંક
૫/૨૦૧૮-૧૯	વિસ્તરણ અધિકારી(ખેતી)	૦૨-૦૧-૨૦૧૯ સવારે ૧૧-૦૦ કલાકે	ક્રમાંક ૧ થી ૫૦
		૦૨-૦૧-૨૦૧૯ બપોરે ૧૫-૦૦ કલાકે	ક્રમાંક ૫૧ થી ૧૧૬
૨/૨૦૧૮-૧૯	આંકડા મદદનીશ	૦૩-૦૧-૨૦૧૯ સવારે ૧૧-૦૦ કલાકે	ક્રમાંક ૧ થી ૫૦
		૦૩-૦૧-૨૦૧૯ બપોરે ૧૫-૦૦ કલાકે	ક્રમાંક ૫૧ થી ૧૦૦
		૦૪-૦૧-૨૦૧૯ સવારે ૧૧-૦૦ કલાકે	ક્રમાંક:- ૧૦૧ થી ૧૩૭

ઉમેદવારે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણિત નકલો)

- (૧) ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ
- (૨) ATTESTATION FORM (નમુનો-૧) (તમામ ઉમેદવારો માટે ફરજિયાત છે.) (નમુનો પંચાયત વિભાગની વેબસાઇટ ઉપર મુકેલ છે.)
- (૩) ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨) (નમુનો પંચાયત વિભાગની વેબસાઇટ ઉપર મુકેલ છે.)
- (૪) ધોરણ-૧૦ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફિકેટ
- (૫) ધોરણ-૧૨ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફિકેટ
- (૬) શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ (વર્ષવાઇઝ / સેમેસ્ટર વાઇઝ તમામ નકલો સામેલ રાખવી)
- (૭) ડીપ્લોમાં / ડીગ્રી સર્ટીફિકેટ
- (૮) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- (૯) કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્ર
- (૧૦) જાતિ અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી ધ્વારા ઇસ્યુ કરેલ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- (૧૧) સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર
- (૧૨) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં સિવિલ સર્જનનું નિયત પ્રમાણપત્ર
- (૧૩) માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના આધાર પુરાવા તથા ડીસ્ચાર્જ બુક
- (૧૪) વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો તથા પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર
- (૧૫) આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય/આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ/શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકુદ/રમતોના ખેલાડીઓના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબના નિયત નમુનાના જરૂરી પ્રમાણપત્ર
- (૧૬) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ૦૪ ફોટો